

Phone call between External Affairs Minister and Foreign Minister of Madagascar

March 01, 2021

વિદેશ મંત્રી અને માડાગાસ્કરનાં વિદેશ મંત્રી વચ્ચે ફોન કૉલ

માર્ચ 01, 2021

તીવ્ર દૂષ્કાળનાં કારણે દક્ષિણ માડાગાસ્કરમાં સર્જાયેલ માનવીય કટોકટીનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રિય એકતા અને સહાયતા માટે માડાગાસ્કર સરકાર દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક અપીલનાં પ્રતિભાવમાં, ભારત સરકાર 1000 મેટ્રિક ટન ચોખા અને HCQ ની 100,000 ટેબ્લેટ્સની ખેપ માડાગાસ્કર મોકલી રહી છે. આ માનવીય સહાય ભારતીય નૌસેનાનાં જહાજ જલશ્રવ પર પહોંચાડવામાં આવી રહી છે, જે ખાદ્યાન્ન અને તબીબી સહાયતા સાથે 3 માર્ચનાં રોજ પ્રસ્થાન કરશે અને માડાગાસ્કરમાં ઈઓલાલા બંદર પર 21-24 માર્ચ 2021 વચ્ચે પહોંચશે તેવું અપેક્ષિત છે.

આજે વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર દ્વારા માડાગાસ્કરનાં વિદેશ મંત્રી મહામહિમ ડૉ. તેલિન્ડ્રાઝેનેરિવેલો જકોબા એ એસ ઓલિવા સાથે ફોન પર વાતચીત દરમિયાન માડાગાસ્કર સરકારને ત્વરિત ભારતીય સહાય કરવાની બાબત પાઠવી હતી. ફોન પર વાતચીત દરમિયાન, વિદેશ મંત્રીએ ભારત અને માડાગાસ્કર વચ્ચેનાં અદ્ભૂત દ્વિવપક્ષીય જોડાણો યાદ કર્યાં હતું અને કહ્યું હતું કે આવી માનવીય કટોકટીમાં માડાગાસ્કરનાં લોકોને સહાય કરવાની વાત આવે છે ત્યારે ભારત હંમેશા પ્રથમ પ્રતિભાવકો પૈકી રહ્યો છે સપ્ટેમ્બર 2018 માં, ભારતીય નૌસેનાનાં જહાજથી 1000 મેટ્રિક ટન ચોખાની ખેપ માડાગાસ્કર પહોંચાડવામાં આવી હતી. જ્યારે ચક્રવાય ડાયને માડાગાસ્કર પર ત્રાટક્યો હતો ત્યારે ભારતીય નૌસેનાં સૌપ્રથમ પ્રતિભાવક હતી અને જાન્યુઆરી 2020 માં આઈએનએસ ઐરાવત દ્વારા ઓપરેશન વેનિલા હેઠળ ત્વરિત સહાય પહોંચાડવામાં આવી હતી. માર્ચ 2020 માં, આઈએનએસ શાર્દૂલે એન્ટિસિરાનાના બંદરની મુલાકાત લીધી હતી અને માડાગાસ્કરનાં ઉત્તર પ્રાંતમાં ભારે પૂરનો સામનો કરવા માટે માડાગાસ્કરને HADR સહાયતા તરીકે 600 ટન ચોખા પહોંચાડ્યા હતા.

વિદેશ મંત્રીએ માડાગાસ્કરનાં વિદેશ મંત્રીને ખાતરી આપી હતી કે હિંદ મહાસાગરમાં દરિયાઈ પાડોશી તરીકે, માડાગાસ્કરની સરકાર અને લોકો હંમેશા ભારતની સરકાર અને લોકોની સહાય અને એકતા પર વિશ્વાસ રાખી શકે છે. બંને વિદેશ મંત્રીઓ પારસ્પરિક હિતનાં અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

આ પ્રવાસ દરમિયાન, આઈએનએસ જલશ્રવ પર ભારતીય નૌસેના તાલીમ ટુકડી પણ હશે જેને બે સપ્તાહ માટે માલાગાસી સ્પેશ્યલ ફોર્સનાં ક્ષમતા નિર્માણ અને તાલીમ માટે કાર્યરત કરવામાં આવી રહી છે.

આઈએન એસ જલશ્રવ કોમોરોસ ગણરાજ્યમાં અંજુન બંદરની પણ મુલાકાત લેશે જ્યાં તે 1000 મેટ્રિક ટન ભારતીય ચોખાની ખેપ પહોંચાડશે. આ ખાદ્યાન્ન સહાયતા પૂરી પાડવાનું ભારતનાં ઉપ રાષ્ટ્રપતિ દ્વારા ઓક્ટોબર 2019 માં તેઓની કોમોરોસની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી જાહેરાત અનુસાર છે.

मैत्रीपूर्ण देशों माडागास्कर अने कोमोरोस आद्यान्ननी सहायता पूरी पाडवी अने क्षमता निर्माण माटे मदद करवी ते वडाप्रधान नरेन्द्र मोदीनां सागर विजन साथे अने हिन्द महासागर प्रांतमां स्पष्ट सुरक्षा प्रदाता तरीके समयनी अेरण पर अरो उतरेला भारत साथे समरेण छे.

नवी दिल्ली
मार्च 01, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.